

# ઔધોગિક તાલીમ સંસ્થા-ઘોઘા



સત્યમેવ જયતે

માહિતી (મેળવવાનાં)  
અધિકાર અધિનિયમ – ૨૦૦૫  
નિયમ સંગ્રહ ૧ થી ૧૭

રો-રો ફેરી સર્વિસ રોડ,તા.-ઘોઘા, જિલ્લો : ભાવનગર

પીન કોડ : ૩૬૪૧૧૦

( સપ્ટેમ્બર – ૨૦૨૩ )

## એનેક્ષર- એ

(સામાન્ય વહીવટી વિભાગ નાં તાં .01/05/2009 ના પરીપત્ર ક્રમાંક: પીએડી -10-2007-335364-આર.ટી.આઈ. સેલ નું બિડાણ)

### પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર કરવામાં આવે છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધોધા દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-4 અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર) (P.A.D.) તૈયાર કરવામાં આવી છે. અને તા.૧૪/૦૮/૨૦૨૩ ની સ્થિતિ એ અદ્યતન કરવામાં આવેલ છે. જેનું મારા દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે. અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપુરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

તા. ૧૪/૦૮/૨૦૨૩ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તા મંડળો નાં પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર (P.A.D.) નું ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.

તારીખ : ૧૪/૦૮/૨૦૨૩

સ્થળ : આઈ.ટી.આઈ. ધોધા

Sd/-

આચાર્ય  
ઔદ્યોગિક તાલીમ સંસ્થા  
ધોધા

## અનુક્રમણિકા

| ક્રમ | વિષય   |
|------|--|
| ૧    | પ્રસ્તાવના   |
| ૨    | નિયમ સંગ્રહ - ૧ સંગઠનની વિગતો કાર્યો અને ફરજો  |
| ૩    | નિયમ સંગ્રહ - ૨ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો                                  |
| ૪    | નિયમ સંગ્રહ - ૩ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ                         |
| ૫    | નિયમ સંગ્રહ - ૪ કાર્યો કરવા માટે નક્કી કરેલા ધોરણો                                       |
| ૬    | નિયમ સંગ્રહ - ૫ કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ                                |
| ૭    | નિયમ સંગ્રહ - ૬ જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ |
| ૮    | નિયમ સંગ્રહ - ૭ નિતી ઘડતર અથવા નિતીના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ          |
| ૯    | નિયમ સંગ્રહ - ૮ રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક                    |
| ૧૦   | નિયમ સંગ્રહ - ૯ અધિકારી/કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડિરેક્ટરી)                          |
| ૧૧   | નિયમ સંગ્રહ - ૧૦ વિનિયમો માં જોગવાઈ કર્યા મુજબ અધિકારી-કર્મચારીઓને મળતું મહેનતાણું       |
| ૧૨   | નિયમ સંગ્રહ - ૧૧ સંસ્થાને ફાળવેલ અંદાજપત્રની વિગતો                                       |
| ૧૩   | નિયમ સંગ્રહ - ૧૨ સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ                                   |
| ૧૪   | નિયમ સંગ્રહ - ૧૩ રાહતો, પરમીટની વિગતો  |
| ૧૫   | નિયમ સંગ્રહ - ૧૪ વિજાણુંરૂપે ઉપલબ્ધ માહિતી   |
| ૧૬   | નિયમ સંગ્રહ - ૧૫ માહિતિ મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો                       |
| ૧૭   | નિયમ સંગ્રહ - ૧૬ જાહેર માહિતી અધિકારીઓનાં નામ , હોદ્દો અને અન્ય વિગતો                    |
| ૧૮   | નિયમ સંગ્રહ - ૧૭ અન્ય ઉપયોગી માહિતી  |

## ૧ - પ્રસ્તાવના

### ૧.૧ પુસ્તિકા (માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫)ની પાશ્ર્ચાદભૂમિકા અંગે જાણકારી :

આ પુસ્તિકા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના નિયમ -૪ પ્રકરણ -૨ અન્વયે સંસ્થાની જાહેર કચેરી તરીકે જાહેર કરવાની થતી માહિતી નો સમાવેશ કરી આ પુસ્તિકા બનાવેલ છે.

### ૧.૨ આ પુસ્તિકા નો ઉદ્દેશ / હેતુ :

આ પુસ્તિકાનો હેતુ / ઉદ્દેશ્ય છે કે જાહેર જનતા (જેમાં જાહેર જનતા ઉપરાંત તાલીમાર્થીઓ / વાલીઓ / કર્મચારીઓનો પણ સમાવેશ) માટે ઉપયોગી થઈ શકે તેવી માહિતી માંગણી થાય તે પૂર્વે ઉપલબ્ધ કરવાનો છે.

### ૧.૩ આ પુસ્તિકા કઈ વ્યક્તિઓ/સંસ્થાઓ/સંગઠનો વગેરેને ઉપયોગી છે?

આ પુસ્તિકા સંસ્થાના કર્મચારી/તાલીમાર્થી/વાલી-વારસદારો/ઉદ્યોગગૃહો/જાહેર કચેરી ઓ/ઉદ્યોગગૃહોના સંગઠનો તેમજ કોઈપણ જાહેર જનતા ને ઉપયોગી થઈ શકે તેમ છે .

### ૧.૪ આ પુસ્તિકા માં આપેલી માહિતી નું માળખું :

આ પુસ્તિકામાં આપેલી માહિતી અધિનિયમ અંગેના નિયમ-૪ પ્રકરણ-૨માં જણાવેલ નિયમ સંદર્ભ - ૧ થી ૧૭ માં જણાવેલ ઢાંચા મુજબનું માળખું રાખવામાં આવેલ છે.

### ૧.૫ વ્યાખ્યાઓ (પુસ્તિકામાં વાપરવામાં આવેલ જુદા જુદા શબ્દોની વ્યાખ્યા આપવા વિનંતી):

૧. આચાર્યશ્રી - સંસ્થાના વડા/કચેરીના વડા .
૨. ફોરમેનશ્રી - સંસ્થાના વડાથી તુરંત નીચેનો હોદ્દો.
૩. સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર - કોર્ષ(ટ્રેડ)ના ઇન્ચાર્જ.
૪. સ્ટોર કીપર - સંસ્થાના સ્ટોર શાખાના સંચાલક.
૫. જુનિયર ક્લાર્ક- સંસ્થા ખાતેનો વહીવટી સ્ટાફ.

### ૧.૬ આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવાં માંગેતો તે માટેની સંપર્ક વ્યક્તિ :

કોઈ વ્યક્તિ આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવાં માંગેતો તે માટેની સંપર્ક વ્યક્તિ એટલે કે સંસ્થાના ફોરમેનશ્રી એમ.જી.મેર.

### ૧.૭ આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્ય-પદ્ધતિ અને ફી:

આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટે માહિતી અધિકાર-૨૦૦૫ અન્વયે ૨૦/- રૂપિયા રોકડા/સ્ટેમ્પ/ડ્રાફ્ટથી ચુકવી પ્રતિ નંગ પાનાના રૂપિયા ચુકવી માહિતી મેળવી શકશે .

## ૨ (નિયમ સંગ્રહ -૧) સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

### ૨.૧ જાહેર તંત્ર ઉદ્દેશ હેતુ :

સંસ્થામાં યાલતા જી.સી.વી.ટી/એન.સી.વી.ટી.ના ટ્રેડીના તાલીમાર્થીઓને નિયત સીલેબસ મુજબ થીયરી અને પ્રેક્ટીકલ અંગે ઘનિષ્ટ તાલીમ આપી / અપાવવી તેમના ટ્રેડમાં કુશળ કારીગરો તરીકે તૈયાર કરવા, આ હેતુ બર લાવવા એફીલેશન મેળવવા, ખરીદી કરવી અને સંસ્થાનું સંચાલન કરવું તથા વહીવટ કરવો અને પ્રાદેશિક કચેરી તાલીમ, રાજકોટ તરફથી સુચવવામાં આવે તેવા અન્ય તાલીમ કાર્યક્રમ ચલાવવા .

### ૨.૨ જાહેર તંત્રનું મીશન :

આ કચેરી જાહેર હેતુ બર આવે તે સારુ ઉપલી કચેરી દ્વારા સુપ્રત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી જેવી કે પ્રવેશ, પરીક્ષા, એફીલેશન, તેમજ સઘન તાલીમ આપી યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટ કરવું આમ સમાજમાં રોજગારી/સ્વરોજગારી ઉભી કરી સમાજ સેવા નું કાર્ય કરવું.

### ૨.૩ જાહેર તંત્રનો ટુકો ઈતિહાસ અને તેની રચના નો સંદર્ભ :

સરકારશ્રી ના ઠરાવ અનુસાર આ સંસ્થા શરૂ કરવામાં આવેલ અને રચનાનો સંદર્ભ છેલ્લા ૨૮ વર્ષથી (૧૯૯૦) ધોધા ખાતે કાર્યરત છે. હાલમાં તેમાં કુલ ૦૬ કોર્ષ(ટ્રેડ) માં ૨૨૪ બેઠકો મંજૂર થયેલ છે.

### ૨.૪ જાહેર તંત્રની ફરજો :

તાલીમાર્થીઓને જી.સી.વી.ટી/એન.સી.વી.ટી.ના હેઠળ નિયત સીલેબસ અનુસાર તાલીમ આપવી/અપાવવી અને તે માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ગોઠવવું અને સંસ્થાનું સંચાલન કરવું.

### ૨.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ/ કાર્યો :

જી.સી.વી.ટી/એન.સી.વી.ટી. હેઠળ નિયત સીલેબસ મુજબ તાલીમાર્થીઓને તાલીમ આપવી/અપાવવી.

### ૨.૬ જાહેર તંત્ર દ્વારા આપવામા આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :

- (૧) તાલીમાર્થીઓને થીયરી અને પ્રેક્ટીકલ તાલીમ આપવી.
- (૨) આ જનરલ આઈ.ટી.આઈ. હોવાથી ઉમેદવારોને મેરીટ મુજબ પ્રવેશ આપવો.
- (૩) એસ.ટી./એસ.સી./અપંગ/મહિલાઓને ટ્યુશનફી ભરવામાંથી મુક્તિ આપવી.
- (૪) તાલીમાર્થીઓને નિયમ અનુસારનું સ્ટાઇપેન્ડ તેમજ સરકારીશ્રી વખતો વખત જાહેર કરે તેવા લાભો આપવા.
- (૫) અભ્યાસક્રમ પૂર્ણ થતાં જે તે યોજનાને અનુરૂપ પરીક્ષાઓ લેવી.

### ૨.૭ જાહેર તંત્રના માળખાનો આલેખ :

આ સંસ્થાની (નોડલ) ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર છે. તેની ઉપલી કચેરી, પ્રાદેશિક વડાની કચેરી એટલે કે નાયબ નિયામકશ્રી (તાલીમ) રાજકોટ છે. તેની ઉપલી કચેરી ખાતાના વડાની કચેરી એટલે કે નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, બ્લોક નં ૧, ત્રીજો માળ, જુના સચિવાલય, ગાંધીનગર છે.

**૨.૮ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :**

- (૧) પુરી તપાસ ખાતરી કર્યા વગર બિનજરૂરી અને અયોગ્ય ફરીયાદો/આક્ષેપો ન કરી સૌના સમય, શક્તિ, નાણા બચે તેમ કરવું/કરાવવું.
- (૨) સંસ્થા ખાતે તથા ખાતા દ્વારા આપવામાં આવતી જાહેરાતો વગેરે બરાબર વાંચી ચોક્કસ રીતે અને સંપૂર્ણ પાલન કરી બિનજરૂરી પૂછતાછ ન થાય તેમ કરવું/કરાવવું.
- (૩) આ સંસ્થા મુખ્યત્વે તાલીમ આપવાનું કાર્ય કરે છે જેથી લોકોએ નોકરી બાબતોની અપેક્ષાઓ આ સંસ્થા પાસેથી ન રાખવી જોઈએ.
- (૪) તાલીમ માટે પોતાના પુત્ર/પુત્રી/પાલ્યને અત્રે મુકી દીધા બાદ વાલી તરીકે અત્રે થી જણાવવામા આવતી સુચનાઓનુ પાલન કરે/કરાવે અને સારી તાલીમ લઈ શકે તે માટે તાલીમાર્થી અને સંસ્થાને પુરો સહયોગ વાલી તરીકે આપવો/ અપાવવો.
- (૫) સંસ્થાના નિતિ નિયમોનુ પાલન કરવું.

**૨.૯ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ :**

- (૧) ઇન્સ્ટીટ્યુટ મેનેજમેન્ટ કમિટીની રચના કરેલ છે.
- (૨) વાલી સંમેલન બોલાવવામાં આવે છે. અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
- (૩) કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે છે.

**૨.૧૦ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર :**

- (૧) આચાર્ય કે ફોરમેનને મૌખિક કે લેખિત માં જાણ કરી શકે છે.
- (૨) સંસ્થા ખાતે ફરીયાદ /સુચન પેટી રાખવામાં આવેલ છે.
- (૩) આઉટસોર્સિંગ સેવા અંતર્ગત સીક્યુરીટી સ્ટાફ રોકવામાં આવેલ છે.

**૨.૧૧ મુખ્ય કચેરીનું સરનામું :** ૨.૭ મુજબ

**૨.૧૨ કચેરી શરૂ થવાનો સમય :** ૧૦ :૩૦ કલાકે

**કચેરી બંધ થવાનો સમય :** ૧૮:૧૦ કલાકે

## ૩ (નિયમ સંગ્રહ-૨) અધિકારીઓ અને કર્મચારીઓની સતા અને ફરજો

### ૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સતા અને ફરજો ની વિગત :

આ સંસ્થા ખાતે વર્ગ-૨, વર્ગ-૩, અને વર્ગ-૪ ના અધિકારી/કર્મચારીઓ છે.  
જે પૈકી વર્ગ-૨ ના અધિકારીનો હોદ્દો “આચાર્યશ્રી” છે. જે સંસ્થાના વડા તરીકે ફરજ બજાવે છે.  
અધિકારી/કર્મચારીઓની સતા અને ફરજો નીચે મુજબ છે.

| સંસ્થાના અધિકારી/ કર્મચારીનો હોદ્દો | સતાઓ                               |                                  |  | ફરજો  |
|-------------------------------------|------------------------------------|----------------------------------|--|---|
|                                     | વહીવટી                             | નાણાંકીય                         | અન્ય   |   |
| આચાર્ય વર્ગ-૨                       | આચાર્ય વર્ગ-૨ ને સુપ્રત કરેલ સતાઓ. | આચાર્ય વર્ગ-૨ને સુપ્રત કરેલ સતાઓ | અનિયમીત તાલીમાર્થીઓના વાલીને જાણ કરવાની સતાઓ, ટ્રેનીંગ મેન્યુઅલમાં જણાવ્યા મુજબ તાલીમાર્થીની રજાઓ મંજૂર કરવી, તાલીમાર્થીઓનું નામ કમી કરવું.                    | -તાલીમ સંબંધી કાર્યવાહી, જેવી કે પ્રવેશ, પરીક્ષા વગેરે<br>-ટાઈમ ટેબલ પ્રમાણે પ્રાયોગીક કાર્ય અને થીયરી કાર્ય યોગ્ય રીતે થાય .<br>-કાયા માલસામાનનું અયોજન કરવું<br>-તમામ ભૌતિક નિરીક્ષણ કરવા.<br>-સંસ્થાના ઈન્સ્ટ્રુક્ટરનો સુચારુ ઉપયોગ થાય.   |
| ફોરમેન ઈન્સ્ટ્રુક્ટર                | -                                  | -                                | -  | -પાળીના ઇન્ચાર્જ તરીકે ફરજો .<br>-તાલીમી નિરીક્ષણ કરવું.<br>-તાલીમી રેકોર્ડ ચકાસણી કરી ઉલ્લેખીત સ્થાને સહી કરવી.<br>-આચાર્યશ્રીને મદદરૂપ થવું<br>-આચાર્યશ્રી મારફતે ઉપલી કચેરીની સૂચનાઓનું તાલીમી સ્ટાફ પાસે અમલ કરાવવો .<br>- ટાઈમ ટેબલ મુજબ તાલીમ કાર્ય ચાલે અને તેની ગુણવત્તા જળવાય તે સારુ સુપરવાઈઝન કરવું. |
| સુપરવાઈઝર ઈન્સ્ટ્રુક્ટર             | -                                  | -                                | -તાલીમાર્થીની હાજરી પુરવાની સતા<br>-અનિયમીત તાલીમાર્થી માટે નિયમોનુસાર રિપોર્ટ કરવાની સતા.<br>-પરીક્ષામાં બેસવાપાત્ર તાલીમાર્થી ઓને સેસનલ માર્ક્સ મુકવાની સતા. | - ટાઈમ ટેબલ મુજબ પ્રાયોગીક અને સૈધાંતિક તાલીમ આપવી.<br>-સ્ટોર સંબંધી માંગણી અને આયોજન કરવું<br>-તાલીમી રેકોર્ડ નિભાવવા .<br>-સ્ટોરસંબંધી રેકોર્ડ નિભાવવા .<br>-આચાર્યશ્રી/ફોરમેન મારફતે મળતી ઉપલી કચેરીની સૂચનાઓનો અમલ કરવો.  |

## ૪ (નિયમ સંગ્રહ-૩) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

ગુજરાત સરકારશ્રી ની નિયત થયેલ કાર્યપદ્ધતિ મુજબ વિવિધ કામગીરી માટે નિર્ણય લેવાની પ્રક્રિયા/કાર્યપદ્ધતિ નીચે મુજબ છે.

### (૧) તાલીમાર્થીની બાબતો :-

સુ.ઇ. દ્વારા ફોરમેનશ્રીને રીપોર્ટ કરે છે. ફોરમેનશ્રી નિયમોનુસાર ભલામણ કરે છે. તેના આધારે આચાર્યશ્રી નિયમોનુસાર નિર્ણયો લે છે.

### (૨) કર્મચારીઓની બાબતો :-

ફોરમેન દ્વારા આચાર્યશ્રીને રીપોર્ટ જે તે શાખા/બ્રાન્ચના કર્મચારીશ્રી સુપ્રત કરે છે. જે તે શાખા/બ્રાન્ચના કર્મચારી લાગુ પડતા નિયમો/વિનયિમો/પરિપત્રો/સ્ટેન્ડીંગ ઓર્ડર વગેરે ટાંકી શાખા નોંધ રજુ કરી નોંધ ઉપર કચેરીના વડાના આદેશો મેળવી કાર્યવાહી પુર્ણ કરે છે.

### (૩) ખરીદી /ભૌતિક નિકાલની બાબતો:-

કર્મચારી જરૂરી માગણીપત્ર ઉપરી કર્મચારી આઇટમોનું અને તેના જથ્થાની ચકાસણી કરી આચાર્યશ્રીને ભલામણ કરે છે. આચાર્યશ્રી સ્ટોર શાખાને સુપ્રત કરે છે. સ્ટોરશાખા નિયમો, વિનયિમો, પરિપત્રો/સ્ટેન્ડીંગ ઓર્ડર મુજબ ખરીદી/નિકાલ કરવા માટે સ્થાનિક સમિતી કે આચાર્યશ્રી મારફતે જે તે અધિકારી દરખાસ્ત કરે છે. સ્થાનિક સમિતી કે જે તે અધિકારી દ્વારા અનુગામી કામગીરી પુર્ણ કરવામાં આવે છે.

### (૪) તાલીમાર્થીઓના લાભોની બાબતો:-

તાલીમાર્થીઓના લાભો જેવા કે સ્ટાઇપેન્ડ, સાયકલ, ટેબલેટ, બેન્કેબલ લોન યોજના વગેરે પ્રાપ્ત કરવા માટે તાલીમાર્થી નિયત કરેલ અરજીપત્ર/માગણીપત્ર પોતાના સુ.ઇ.ને રજુ કરે છે. આવી અરજીપત્ર અને માગણીપત્ર ફોરમેનશ્રીમારફતે આચાર્યશ્રીને રજુ કરે છે. આચાર્યશ્રી જે તે યોજનાના કર્મચારી/કો-ઓડેનેટર સુપ્રત કરે છે. આવા કર્મચારી અરજીપત્ર અને માગણીપત્રક એકત્રિત કરી મંજૂરી કર્તા સમિતિ (સ્ટાઇપેન્ડ સમિતી/ ટેબલેટ સમિતી/ લોન સહાય ટાસ્કફોર્સ સમિતી)ની મીટીંગ બોલાવી લાભાર્થીઓને મળવા પાત્રતા મુજબ લાભોને મંજૂર કરાવે છે.

### (૫) જાહેર જનતાની બાબતો :-

જાહેર જનતા સીધા આચાર્યશ્રીને મળી શકે છે. આચાર્યશ્રી જનતાની મૌખિક/લેખિત રજુઆતને સંબંધિત કર્મચારી/કો-ઓડેનેટર ને સુપ્રત કરે છે. સરકારશ્રીના નિયમો, વિનયિમો, પરિપત્રો અને સ્ટેન્ડીંગ ઓર્ડર મુજબ નિકાલ કરે છે. જેની જાણ જનતાને કરવામાં આવે છે. જ્યાં જરૂરી જણાય તો ઉપલી કચેરીનું માર્ગદર્શન/મંજૂરી માંગવામાં આવે છે. તે મળે પછી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.



## પ (નિયમ સંગ્રહ –૪) કાર્યો કરવા માટે નક્કી કરેલા ધોરણો

### પ.૧ વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કી કરેલ ધોરણોની વિગતો:

ટ્રેનીંગ મેન્યુઅલ મુજબ જે તે ટ્રેડ માટે સિલેબસ મુજબ, થીયરી, પ્રેક્ટીકલ જેવા વિષયો માટે પ્રતિદિન નિયત કલાક રાખી તાલીમના ટાઇમ ટેબલ મંજૂર કરવામાં આવે છે જેનું આચાર્યશ્રી તથા ઉપલી કચેરીઓના અન્ય અધિકારીઓ દ્વારા સુપરવીઝન તેમજ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આ સઘળું સરકારશ્રી ની વખતો વખત ની સુચના મુજબ કરવામાં આવે છે. ઉપરોક્ત નીચે જણાવ્યા સિવાય કોઇ ખાસ ધોરણો નક્કી કરવામાં આવેલ નથી.

૧. પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી મેરીટ મુજબ પ્રવેશ પાત્ર થાય છે.
૨. એક સેમેસ્ટરમાંથી બીજા સેમેસ્ટરમાં જવા માટે ૮૦% હાજરી હોવી અનિવાર્ય છે.
૩. સેમેસ્ટરના અંતે ૮૦% હાજરી ધરાવનાર જ પરીક્ષામાં બેસી શકે છે.
૪. એન.સી.વી.ટી. અને જી.સી.વી.ટી.ના કોર્સ માટે સેમેસ્ટરના અંતે નિયમિત અને રીપીટર તાલીમાર્થી માટે સંબંધીત કાઉન્સિલના ટાઇમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ હાથ ધરવામાં આવે છે.
૫. એન.સી.વી.ટી કોર્સ માટે એમ.એસ.ડી.ઈ (ડીજીઈટી) દ્વારા ઠરાવેલ સીલેબસ લાગુ પડે છે.
૬. જી.સી.વી.ટી. કોર્સ માટે રાજ્ય સરકારે માન્ય કરેલ સીલેબસ લાગુ પડે છે.
૭. વિવિધ એકમો/કંપનીઓ દ્વારા માંગણી થયેલી કેમ્પસ ઇન્ટરવ્યુકે નામની ભલામણ હાથ ધરવામાં આવે છે.
૮. ટ્રેનીંગ મેન્યુઅલ ની જોગવાઈ મુજબ થીયરી કાર્ય અને પ્રેક્ટીકલ કાર્ય તેમજ જણાવેલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
૯. ટ્રેનીંગ મેન્યુઅલની જોગવાઈઓ મુજબ તાલીમાર્થીઓની રજા મંજૂર કરવામાં આવે છે.
૧૦. ઉપલી કચેરીઓ દ્વારા સંસ્થાના નિરીક્ષણો હાથ ધરવામાં આવે છે.

## ૬ (નિયમ સંગ્રહ -૫) કાર્યો કરવા માટેના નિયમો, વિનિમયો, સૂચનાઓ નિયમસંગ્રહ અને દફતરો

**૬.૧ દસ્તાવેજોનું નામ /મથાળું /દસ્તાવેજ પરનું લખાણ/ વ્યક્તિને નકલ ક્યાંથી મળશે/  
વ્યક્તિને નકલ માટે લેવાની ફી (જો હોય તો )**

| દસ્તાવેજોનું નામ/મથાળું ને લખાણ.                                  | નકલ ક્યાંથી મળશે  | નકલ માટેની ફી  |
|---|---|--|
| (૧) ગુજરાત સીવીલ સર્વિસ રૂલ્સ<br>(કર્મચારી માટેના નિયમો)          | સા.વ. વિભાગની વેબસાઇટ અથવા<br>સંસ્થા ખાતેથી.                              | (૧) જ્યાં વેબસાઇટ<br>દસ્તાવેજો હોય ત્યાં<br>જે તે સાઇટ ના<br>નિયમો જાણી<br>ડાઉનલોડ કરી<br>શકાશે.             |
| (૨) ગુજરાત નાણાંકીય નિયમો<br>(નાણાકીય સત્તાઓ અંગેના નિયમો)        | નાણાં વિભાગની વેબસાઇટ અથવા<br>સંસ્થા ખાતેથી.                              |  |
| (૩) સેવા, શિસ્ત અને અપિલના નિયમો<br>(કર્મચારીઓ માટેના નિયમો)      | સા.વ. વિભાગની વેબસાઇટ ખાતેથી<br>અથવા ખાતાની વેબસાઇટ અથવા<br>સંસ્થા ખાતેથી |  |
| (૪) ખાતાકીય ભરતીના નિયમો (ખાતામાં થતી<br>સ્ટાફ ભરતી માટેના નિયમો) | ખાતાની વેબસાઇટ અથવા સંસ્થા<br>ખાતેથી                                      | (૨) જ્યાં સંસ્થા ખાતે<br>દર્શાવેલ છે ત્યાં<br>દરેક પાનાના<br>રૂ.૨(બે) પ્રમાણે<br>ફી ચુકવેથી નકલ<br>મળી શકશે. |
| (૫) ટ્રેનીંગ મેન્યુઅલ<br>(તાલીમ અને તાલીમાર્થીઓ માટેના<br>નિયમો)  | ખાતાની વેબસાઇટ અથવા MSDE ની<br>વેબસાઇટ ઉપરથી અથવા સંસ્થા<br>ખાતેથી        |  |
| (૬) એપ્રેન્ટિસ એક્ટ<br>(એપ્રેન્ટિસ માટેના નિયમો)                  | ખાતાની વેબસાઇટ અથવા MSDE ની<br>વેબસાઇટ ઉપરથી અથવા સંસ્થા<br>ખાતેથી        |  |
| (૭) ગુજરાત સરકારશ્રીની ખરીદી<br>નીતી-૨૦૧૭                         | ઉદ્યોગ અને ખાણ વિભાગની વેબસાઇટ<br>અથવા સંસ્થા ખાતેથી                      |  |
| (૮) સ્ટેન્ડીંગ ઓર્ડર ઓફ ઇએસટી બ્રાન્ચ                             | ખાતાની વેબસાઇટ અથવા સંસ્થા<br>ખાતેથી                                      |  |
| (૯) સ્ટેન્ડીંગ ઓર્ડર ઓફ ટ્રેનીંગ બ્રાન્ચ.                         | ખાતાની વેબસાઇટ અથવા સંસ્થા<br>ખાતેથી                                      |  |
| (૧૦) સ્ટેન્ડીંગ ઓર્ડર ઓફ એકાઉન્ટ બ્રાન્ચ                          | ખાતાની વેબસાઇટ અથવા સંસ્થા<br>ખાતેથી                                      |  |

## ૭ (નિયમસંગ્રહ-૬)

જાહેર તંત્ર અથવા તેના નિયમસંગ્રહ હેઠળની વ્યક્તિઓ પાસેના  
દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક

| અનુ. નં. | દસ્તાવેજોની કક્ષા | દસ્તાવેજોનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ  | દસ્તાવેજો મેળવવાની કાર્યપદ્ધતિ        | નીચેની વ્યક્તિ પાસે છે/ તેના નિયંત્રણમાં છે. |
|----------|-------------------|---|---------------------------------------|--|
| ૧        | તાલીમ             | સંસ્થા ખાતે તાલીમ બાબતો અંગેના નિયમો, વિનિયમો, પરિપત્રો કે જે સંસ્થાના કર્મચારીઓ કે તાલીમાર્થીઓ સંબંધીત થયેલ પત્ર વ્યવહાર/ કાર્યવાહીઓ અંગેનો રેકોર્ડ            | માહિતી અધિનિયમ – ૨૦૦૫ મુજબ નિયમોનુસાર | શ્રી એમ.જી.મેર                               |
| ૨        | સ્ટોર શાખા        | સંસ્થા ખાતે સ્ટોર અંગેની બાબતો અંગેના નિયમો, વિનિયમો, પરિપત્રો કે જે સ્થાનિક તેમજ ઉપલી કચેરી દ્વારા થયેલ ખરીદી/ મેન્ટેનન્સ / હરાજી/ તબદીલી વગેરે અંગેનો રેકોર્ડ | માહિતી અધિનિયમ – ૨૦૦૫ મુજબ નિયમોનુસાર | શ્રી એચ.જી.દેવમુરારી                         |

## ૮ (નિયમ સંગ્રહ-૭)

નીતિ અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ

નીતિ અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.

નીતિ ઘડતર :

| અનુ.નં | વિષય/મુદ્દો                   | શુ જનતાની સહભાગિતા સુનિસ્થિત કરવાનું જરૂરી છે. | જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા                         |
|--------|-------------------------------|--|--|
| ૧      | ઇન્સ્ટીટ્યુટ મેનેજમેન્ટ કમિટી | હા   | કમિટીની રચના કરવામાં આવે છે અને તેનું સમયાંતરે પુનઃગઠન થાય છે. |

## પ્રકરણ-૯ (નિયમ સંગ્રહ -૯)

### રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

આ સરકારી સંસ્થા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના રોજગાર અને તાલીમ ખાતાના તાબા હેઠળની સંસ્થા છે વળી નિયત હાલના માળખા પ્રમાણે ઉપર મુદ્દા ૨.૭ મુજબ ઉપલી કચેરી ઓ ધરાવે છે. વળી એન.સી.વી.ટી તે ભારત સરકારના “મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયરશીપ હેઠળના “ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેનીંગ” દિલ્હી દ્વારા નિયત કરાયેલ રાષ્ટ્રીય કક્ષાની કમીટી છે. જેથી એન.સી.વી.ટી કક્ષાના ટ્રેડ આઈ.ટી.આઈ.માં જે ચાલે છે તે રાષ્ટ્રીય કક્ષાની તાલીમ યોજના ધરાવે છે. પરંતુ તેનો અમલ જે તે રાજ્ય સરકાર કરે છે.

આમ માલિક તરીકે ગુજરાત સરકારના અને નિયામકશ્રી રોજગાર તાલીમ નિયુક્ત થયેલા ખાતાના વડા (હાલમાં શ્રી સુપ્રિત સિંઘ ગુલાટી સાહેબ) છે. પ્રદેશિક વડા તરીકે શ્રી એમ.એમ.દેવે સાહેબ (નાયબ નિયામક (તાલીમ), રાજકોટ વિભાગ ,રાજકોટ) છે. આઈ.ટી.આઈ. ધોધા ના વડા સુશ્રી.પી.આર.રાહોડ(આચાર્ય વર્ગ-૨) છે. તેમજ આ સંસ્થાના કચેરી વડા/આચાર્ય છે.

આમ આ જાહેર કચેરીનું માળખું ઉપર મુજબ છે. જેથી વખતો વખત જે તે વડાઓ દ્વારા વિવિધ વિષય માટે મિટિંગો યોજવામાં આવે છે. અને તેની કાર્યવાહીની નોંધ પણ બહાર પાડવામાં આવે છે. જે તે સંબંધિત કચેરી ખાતેથી મળી શકે.

| બોર્ડ/ પરિષદ/ સમિતીનું વિવરણ                  | બોર્ડ/ પરિષદ/ સમિતીનું કાર્ય  | હેડ ક્વાટર   |
|---|---|--|
| NCVT<br>(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટેનીંગ)   | -રાજ્ય ની સંસ્થાઓના કોર્ષની માન્યતા આપવી.<br>-સમયાંતરે કોર્ષના સિલેબસ અંગે નિર્ણય લેવા.<br>-કોર્ષ અંગેના ધારા-ધોરણો નિયમો ઘડવા અને અમલ કરાવવો.<br>-કોર્ષમાં દાખલ થયેલાઓની પરીક્ષા લેવી.                 | નવી દિલ્હી   |
| GCVT<br>( ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટેનીંગ) | -રાજ્ય કક્ષાના કોર્ષની પરીક્ષાઓના નિયમો/ધારા-ધોરણો બનાવવા.<br>-રાજ્ય કક્ષાના કોર્ષમાં દાખલ થતા તાલીમાર્થીઓની પરીક્ષા લેવી.<br>-NCVT કક્ષાના કોર્ષની પરીક્ષા માટે રાજ્યકક્ષાની કચેરી તરીકે કાર્ય કરે છે. | બ્લોક નં.૮ બીજોમાળ, ડી. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર |
| IMC ( ઈન્સ્ટીટ્યુટ મેનેજમેન્ટ કમિટી           | -સંસ્થાને ટેકનીકલ માર્ગદર્શન આપવું.<br>-સંસ્થાની નીતિઓ અને કાર્યક્રમો માં સલાહ સૂચનો પુરા પાડવા .   | ઓ.તા.સંસ્થા ધોધા                                   |
| સ્ટાઈપેન્ડ કમિટી                              | -સંસ્થાના તાલીમાર્થીઓ પૈકી જેઓએ સંસ્થાકીય સ્ટાઈપેન્ડ મેળવવા અરજી કરેલ છે તેઓની અરજી અંગે નિર્ણય લઈ પાત્રતા ધરાવનારનું સ્ટાઈપેન્ડ મંજૂર કરવું.   | ઓ.તા.સંસ્થા ધોધા                                   |
| જીલ્લા બેંકબલ લોન સહાય સમિતી ( TFC)           | સંસ્થાના ભૂતપૂર્વે તાલીમાર્થીઓને સ્વરોજગાર પ્રાપ્ત કરવા માટે સહાય કરવા સારું સબસીડી યુક્ત લોનની પાત્રતા/યોગ્યતાની ચકાસણી કરી તેઓની માંગણી બેંકને મોકલી આપવા બાબતે નિર્ણય લે છે .                        | ઓ.તા.સંસ્થા ધોધા                                   |
| સ્થાનિક ખરીદ સમિતી                            | સંસ્થાની સ્થાનિક ખરીદી અંગે નિર્ણય લે છે.   | ઓ.તા.સંસ્થા ધોધા                                   |
| સ્થાનિક કડમેશન સમિતી                          | સંસ્થા ખાતે બીન વપરાશી યીજ વસ્તુઓના નિકાલ માટે નિર્ણય અને કાર્યવાહી કરે છે.   | ઓ.તા.સંસ્થા ધોધા                                   |
| મહિલા સતામણી કમિટી                            | કચેરીમાં નોકરી કરતી મહિલા કર્મચારી/તાલીમથીની કોઈ જાતીય સતામણી ના કરે તે બાબત નિર્ણય લે છે.  | ઓ.તા.સંસ્થા ધોધા                                   |

**૧૦ (નિયમ સંગ્રહ - ૯)**

**અધિકારી/કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડિરેક્ટરી)**

| ક્રમ | અધિકારી/<br>કર્મચારીનું નામ | હોદ્દો               | S.T.D.<br>કોડ | ફોન નંબર<br>ઓફિસ | ઈમેલ એડ્રેસ            |
|------|-----------------------------|----------------------|---------------|------------------|------------------------|
| ૧    | સુશ્રી.પી.આર.રાહોડ          | આચાર્ય (વર્ગ ૨)      | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૨    | શ્રી એમ.જી.મેર              | ફોરમેન ઇન્સ્ટ્રક્ટર  | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૩    | શ્રી જે.કે.ટીમાણીયા         | સુ.ઈ. વાયરમેન        | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૪    | શ્રી એચ.આર.સોલંકી           | સુ.ઈ. વાયરમેન        | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૫    | શ્રી એમ.એસ.કાતરીયા          | સુ.ઈ-વેલ્ડર          | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૬    | શ્રી બી.એમ.મકવાણા           | સુ.ઈ-ફિટર            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૭    | શ્રી એચ.એમ.બોરીયા           | સુ.ઈ કોપા            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૮    | શ્રી.બી.પી.પડિયા            | સુ.ઈ-મેથ્સ & ડ્રોઈંગ | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૯    | કુ.એમ.એસ.રાજ્યગુરુ          | સુ.ઈ-ફિટર            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૦   | શ્રી પી.એન.પડશાળા           | સુ.ઈ-ફિટર            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૧   | શ્રી કે.આર.ગોહિલ            | સુ.ઈ ઈ.એસ            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૨   | શ્રી જી.એન.રાહોડ            | સુ.ઈ-વેલ્ડર          | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૩   | શ્રી જે.એલ.કોરડીયા          | સુ.ઈ કોપા            | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૪   | શ્રી વી.એસ.માંડળીયા         | સુ.ઈ. વાયરમેન        | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૫   | શ્રી એન.એસ.રાહોડ            | સુ.ઈ. વાયરમેન        | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૬   | શ્રી વી.વી.ગોહિલ            | સુ.ઈ.ઈલેક્ટ્રીશ્યન   | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૭   | શ્રી એમ.એસ.ગોહિલ            | સુ.ઈ.ઈલેક્ટ્રીશ્યન   | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |
| ૧૮   | શ્રી એચ.જી.દેવમુરારી        | આસી.સ્ટોર કીપર       | ૦૨૭૮          | ૨૮૮૨૪૧૦          | prlghoghaiti@yahoo.com |

## ૧૧ (નિયમસંગ્રહ -૧૦)

### વિનિયમો માં જોગવાઈ કર્યા મુજબ અધિકારી-કર્મચારીઓને મળતું મહેનતાણું

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતુ માસિક મહેનતાણું.

| ક્રમ નં | નામ                  | હોદ્દો               | માસિક મહેનતાણું  |          | વળતર ભથ્થુ                                 | વિનિયમમાં જણાવ્યા મુજબ મહેનતાણું નક્કી કરવાની કાર્યપધ્ધતિ. |
|---------|----------------------|----------------------|------------------|----------|--|--|
|         |                      |                      | પગાર ધોરણ        | કુલ પગાર |  |  |
| ૧       | સુશ્રી.પી.આર.રાઠોડ   | આચાર્ય (વર્ગ ૨)      | ૪૪૮૦૦-૧૪૨૪૦૦     | ૭૦૧૫૦    | રાજ્ય સરકારશ્રીના વખતો વખતના નિયમો અનુસાર. |  |
| ૨       | શ્રી એમ.જી.મેર       | ફોરમેન ઇન્સ્ટ્રક્ટર  | ૩૮૦૯૦ ફિક્સ પગાર | ૩૮૦૯૦    |  |  |
| ૩       | શ્રી જે.કે.ટી.માણીયા | સુ.ઈ. વાયરમેન        | ૩૮૮૦૦-૧૨૬૬૦૦     | ૧૦૪૮૦૦   |  |  |
| ૪       | શ્રી એચ.આર.સોલંકી    | સુ.ઈ. વાયરમેન        | ૩૮૮૦૦-૧૨૬૬૦૦     | ૮૦૭૦૦    |  |  |
| ૫       | શ્રી એમ.એસ.કાતરીયા   | સુ.ઈ-વેલ્ડર          | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૬૬૫૦    |  |  |
| ૬       | શ્રી બી.એમ.મકવાણા    | સુ.ઈ-ફિટર            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૬૬૫૦    |  |  |
| ૭       | શ્રી એચ.એમ.બોરીયા    | સુ.ઈ કોપા            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૬૬૫૦    |  |  |
| ૮       | શ્રી.બી.પી.પડિયા     | સુ.ઈ-મેથ્સ & ડ્રોઈંગ | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૨૧૫૦    |  |  |
| ૯       | કુ.એમ.એસ.રાજયગુરુ    | સુ.ઈ-ફિટર            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૨૧૫૦    |  |  |
| ૧૦      | શ્રી પી.એન.પડશાળા    | સુ.ઈ-ફિટર            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૫૨૧૫૦    |  |  |
| ૧૧      | શ્રી કે.આર.ગોહિલ     | સુ.ઈ ઈ.એસ            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૪૭૮૫૦    |  |  |
| ૧૨      | શ્રી જી.એન.રાઠોડ     | સુ.ઈ-વેલ્ડર          | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૪૭૮૫૦    |  |  |
| ૧૩      | શ્રી જે.એલ.કોરડીયા   | સુ.ઈ કોપા            | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૪૭૮૫૦    |  |  |
| ૧૪      | શ્રી વી.એસ.માંડળીયા  | સુ.ઈ. વાયરમેન        | ૨૮૨૦૦-૮૨૩૦૦      | ૪૭૮૫૦    |  |  |
| ૧૫      | શ્રી એન.એસ.રાઠોડ     | સુ.ઈ. વાયરમેન        | ૩૧૩૪૦ ફિક્સ પગાર | ૩૧૩૪૦    |  |  |
| ૧૬      | શ્રી વી.વી.ગોહિલ     | સુ.ઈ.ઈલેક્ટ્રીશ્યન   | ૩૧૩૪૦ ફિક્સ પગાર | ૩૧૩૪૦    |  |  |
| ૧૭      | શ્રી એમ.એસ.ગોહિલ     | સુ.ઈ.ઈલેક્ટ્રીશ્યન   | ૩૧૩૪૦ ફિક્સ પગાર | ૩૧૩૪૦    |  |  |
| ૧૮      | શ્રી એચ.જી.દેવમુરારી | આસી.સ્ટોર કીપર       | ૩૧૩૪૦ ફિક્સ પગાર | ૩૧૩૪૦    |  |  |

## ૧૨ (નિયમ સંગ્રહ -૧૧) સંસ્થાને ફાળવેલ અંદાજપત્રની વિગતો

તમામ યોજનાઓ, સુચીત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ , નિમોણ અને તકનીકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે.

૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે પ્રવૃત્તિઓ અંદાજપત્ર ની વિગતોની માહિતી નીચેના નમુનામા આપો. વર્ષ -

૨૦૧૭-૨૦૧૮.

| ક્રમ નં | યોજનાનું નામ સદર | પ્રવૃત્તિ   | પ્રવૃત્તિ શરૂ થવાની તારીખ | પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ | સુચીત રકમ (અ) | મંજૂર થયેલ રકમ | છૂટી કરેલ/ ચુકવેલ રકમ (હતા ની સંખ્યા ) | છેલ્લા વર્ષેનું ખરેખર ખર્ચ | કાર્યોની ગુણવત્તા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદારી અધિકારી |
|---------|------------------|---|---------------------------|---------------------------------|---------------|----------------|--|----------------------------|---|
| ૧       | ૨                | ૩   | ૪                         | ૫                               | ૬             | ૭              | ૮                                      | ૯                          | ૧૦  |
| ૧       | 57 CTS PLAN      | જી.સી.વી.ટી. તેમજ ટ્રેકાગાળાના કોષે ચલાવવા માટે રાજ્ય કારીગર તાલીમ (સીટીએસ) તેમજ કોષે ની વિવિધ બેચ માટે ખાસ કન્ડેમેશન પ્લાન | સામેલ પત્રક મુજબ          |                                 |               |                |  |                            |   |

## ૧૩ (નિયમ સંગ્રહ – ૧૨)

### સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ

૧૩.૧ નીચેના નમૂના મુજબ માહિતી આપો.

| કાર્યક્રમ/યોજનાના નામ  | સાયકલ યોજના  | ટેબલેટ યોજના  | બેંકબલ લોન સહાય યોજના   |
|--|--|---|---|
| કાર્યક્રમ યોજનાનો સમયગાળો  | કોર્ષનો સમયગાળો  | નિયત કરેલ કોર્ષનો સમયગાળો   | કોર્ષ પૂર્ણ થયા બાદ   |
| કાર્યક્રમનો ઉદ્દેશ   | કન્યાઓને અવર જવર માટે સુગમતા /અનુકુળતા માટે                                      | શૈક્ષણિક કાર્યમાં સહાયરૂપ માટે                                    | અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વ રોજગારી ઉભી કરવા /સહાય કરવા માટે   |
| કાર્યક્રમના ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષમાટે)  | પાત્રતા ધરાવતા તમામ ને   | પાત્રતા ધરાવતા અને ગ્રાન્ટની ઉપલબ્ધતા અનુસાર                      | પાત્રતા ધરાવતા ગ્રાન્ટની ઉપલબ્ધતા અનુસાર  |
| લાભાર્થીની પાત્રતા   | -તમામ ટ્રેડમાં માત્ર મહિલા તાલીમાર્થીઓ   | કોમ્પ્યુટર ટ્રેડના તાલીમાર્થીઓને તેમજ આ.ઇ.ટી.ટ્રેડના તાલીમાર્થીઓ. | એન.સી.વી.ટી કે જી.સી.વી.ટીના કોર્ષ પૂર્ણ કરી ઉત્તિર્ણ થયેલ હોય તેવા જે તે ક્ષેત્રનો અનુભવ ધરાવતા ઉમેદવારોને |
| લાભ અંગેની કુલ જરૂરીયાત  | વાલીની વાર્ષિક આવકનો દાખલો.  | સંસ્થાનું આઇ.ટી.આઇ.ઓળખકાર્ડ.તેમજ માન્ય ખરીદીના બીલો.              | અરજી પત્રમાં જણાવેલ તમામ આધાર પુરાવાઓ   |
| કાર્યક્રમનો લાભ લેવાની પધ્ધતિ  | પોતાના ટ્રેડ સુ.ઇ.ને અરજીપત્ર રજૂ કરવું  |   |   |
| પાત્રતા નક્કી કરવા અંગેના માપદંડો  | વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય માટે ૧,૨૦,૦૦૦/-અને શહેરી માટે ૧,૫૦,૦૦૦/-થી ઓછી હોય તો |   |   |
| કાર્યક્રમમાં આપેલ લાભની વિગતો  | સાયકલ ભૌતિક રીતે સુપ્રત કરાય છે.   |   |   |
| સહાયકી વિતરણની કાર્યપધ્ધતિ   | સંસ્થા ખાતે સીધા તાલીમાર્થીને  |   |   |
| અરજી ક્યાં કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.   | સંસ્થા ખાતે ટ્રેડ સુ.ઇ.નો  |   |   |
| અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)   | નથી  |   |   |
| અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)   | નથી  |   |   |
| અરજી પત્રકનો નમુનો (લાગુ પડતું હોય તો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શું શું દર્શાવવું તેનો ઉલ્લેખ કરવો. | સંસ્થા ખાતેથી મળી રહે છે.  |   |   |



|  |   |  |  |
|--|---|--|--|
| બિડાણોની યાદી<br>(પ્રમાણપત્ર /<br>દસ્તાવેજો)                                 | ફોટો આઇ ડી/આવકનો દાખલો  |  |  |
| બિડાણનો નમુનો  | સામેલ છે.   |  |  |
| પ્રક્રિયાને લગતી<br>સમસ્યાઓ અંગે ક્યાં<br>સંપર્ક કરવો.                       | ટ્રેડ સુ.ઇ.ને .   |  |  |
| ઉપલબ્ધ નીચેની<br>વિગતો (જિલ્લા<br>ક્લા, ઘટક કલ્લા વગેરે<br>જેવા વિવિધ સ્થળો) | લાભાર્થીઓની સંખ્યાને આધારે<br>નાણાંની માંગણી થાય છે. આ<br>નાણા નાયબનિયામકશ્રી(તા)<br>પ્રાદેશિક કચેરી દ્વારા ગ્રાન્ટ રૂપે<br>ફાળવવામાં આવે છે. |  |  |

નીચેના નમુનામા લાભાર્થી ઓની યાદી

| ક્રમ<br>નં.કોડ   | લાભાર્થી નુ નામ | સહાયકી ની રકમ | માતા-પિતા/<br>વાલી | પસંદગી નુ<br>માપદંડ | સરનામું |      |         |        |
|--|-----------------|---------------|--------------------|---------------------|---------|------|---------|--------|
|  |                 |               |                    |                     | જિલ્લો  | શહેર | નગર/ગામ | ઘર નં. |
| લાભાર્થીઓને લાભ મળે તે મુજબ યાદી સંસ્થા ખાતે ઉપલબ્ધ છે . |                 |               |                    |                     |         |      |         |        |

## ૧૪ (નિયમ સંગ્રહ – ૧૩) રાહતો, પરમીટ કે અધિકૃત મેળવનારની વિગતો

નીચેના નમૂના માહિતી આપો.

- કાર્યક્રમનું નામ.
- પ્રકાર (રાહત/પરમીટ/અધિકૃત)
- ઉદ્દેશ.
- પાત્રતા.
- પાત્રતા માટેના માપદંડો.
- પૂર્વ જરૂરિયાતો.
- લાભ મેળવવાની પદ્ધતિ.
- રાહત/પરમીટ/અધિકૃતિની સમય મર્યાદા.
- અરજીથી (લાગુ પડતું હોય ત્યાં).
- અરજીનો નમૂનો(લાગુ પડતું હોય ત્યાં).
- બિડાણોની યાદી (પ્રમાણપત્રો/દસ્તાવેજો)
- બિડાણોના નમૂનો.

| ક્રમનં.કોડ       | લાભાર્થીનું<br>નામ | સહાયકી<br>ની રકમ | માતા-પિતા<br>/ વાલી | પસંદગીનો<br>માપદંડ | સરનામું |      |         |        |
|------------------|--------------------|------------------|---------------------|--------------------|---------|------|---------|--------|
|                  |                    |                  |                     |                    | જિલ્લો  | શહેર | નગર/ગામ | ઘર નં. |
| લાગું પડતું નથી. |                    |                  |                     |                    |         |      |         |        |

- રાહત માટે નીચેની માહિતી પણ આપવી.
- આપેલ લાભની વિગત.
- લાભનું વિતરણ.

## ૧૫ (નિયમ સંગ્રહ -૧૪ ) વિજાણરૂપે ઉપલબ્ધ માહિતી

- ૧) આ ખાતાની વેબસાઇટ [www.talimrojgar.gujarat.gov.in](http://www.talimrojgar.gujarat.gov.in) પરથી તેમજ સદર સંસ્થાની વેબસાઇટ [www.itighogha.org](http://www.itighogha.org) પરથી સંસ્થાની તેમજ તાલીમાર્થીઓની કેટલીક માહિતી વિજાણૂ માધ્યમથી ઉપલબ્ધ થઈ શકે છે.
- ૨) તાલીમાથી ને રોજિદી/ રોજબરોજ ની કેટલીક આંકડાકીય માહિતી વિજાણૂ રૂપે ઉપલબ્ધ રહેશે.
- ૩) પોટેલ પ્રોગ્રામ આધારીત માહિતી સિવાયની માહિતી ભૌતિક રીતે હાડે કોપીમા સંસ્થા ખાતે ઉપલબ્ધ રહેશે.

## ૧૬ (નિયમ સંગ્રહ -૧૫ )

### માહિતિ મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

વર્તમાનપત્રો

નોટિસ બોર્ડ

જાહેર તંત્ર ની વેબસાઇટ

1. સંસ્થા ખાતે રૂબરૂ અરજી કરે છે .
2. સંસ્થાના નોટિસ બોર્ડ ઉપરથી .
3. સંસ્થાની વેબસાઇટ ઉપરથી .
4. જાહેર માહિતિ અધિકારી / આસી . માહિતિ અધિકારીને રૂબરૂ મળી માંગણી કરવાથી.

## ૧૭ (નિયમ સંગ્રહ-૧૬)

### સરકારી માહિતી અધિકારીઓનાં નામ , હોદ્દો અને અન્ય વિગતો

સરકારી તંત્રનું નામ : આઇ.ટી.આઇ. ધોધા

સરકારી માહિતી અધિકારીઓ:

|   | નામ                | હોદ્દો        | S.T.D. કોડ | ફોન નંબર | ઇ-મેઇલ   | સરનામુ   |
|---|--------------------|---------------|------------|----------|--|--|
| ૧ | સુશ્રી.પી.આર.રાઠોડ | આચાર્ય વર્ગ-૨ | ૦૨૭૮       | ૨૮૮૨૪૧૦  | <a href="mailto:prlghoghaiti@yahoo.com">prlghoghaiti@yahoo.com</a> | ઓ.તા.સંસ્થા, ધોધા<br>રો-રો ફેરી સર્વિસ રો<br>,તા: ધોધા,<br>જી. ભાવનગર<br>પીન -૩૬૪૧૪૦ |

મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ :

|   | નામ            | હોદ્દો              | S.T.D. કોડ | ફોન નંબર | ઇ-મેઇલ   | સરનામુ   |
|---|----------------|---------------------|------------|----------|--|--|
| ૧ | શ્રી એમ.જી.મેર | ફોરમેન ઇન્સ્ટ્રક્ટર | ૦૨૭૮       | ૨૮૮૨૪૧૦  | <a href="mailto:prlghoghaiti@yahoo.com">prlghoghaiti@yahoo.com</a> | ઓ.તા.સંસ્થા, ધોધા<br>રો-રો ફેરી સર્વિસ રો<br>,તા: ધોધા,<br>જી. ભાવનગર<br>પીન -૩૬૪૧૪૦ |

વિભાગીય એપેલેટ (કાયદા)સત્તાધિકારી :

| ક્રમ | નામ                 | હોદ્દો                           | S.T.D. કોડ | ફોન નંબર | ફેક્સ   | ઇ-મેઇલ   | સરનામુ  |
|------|---------------------|----------------------------------|------------|----------|---------|--|---|
| ૧    | શ્રી કે.બી.કણઝારીયા | નાયબ નિયામક (તાલીમ) રાજકોટ વિભાગ | ૦૨૮૧       | ૨૪૭૬૮૫૦  | ૨૪૫૮૪૮૮ | <a href="mailto:rddrajkotitil@gmail.com">rddrajkotitil@gmail.com</a> | નાયબ નિયામક (તાલીમ),<br>બીજો માળ,<br>જીલ્લા સેવા સદન-૨<br>કમ્પાઉન્ડ, રાજકોટ<br>૩૬૦૦૦૧ |

૧૮ (નિયમ સંગ્રહ - ૧૭)  
અન્ય ઉપયોગી માહિતી